

CR EN/56/2026-:: અરજદારની બી.એન.એસ.એસ.કલમ-૪૯૭ અને ૫૦૩ મુજબની અરજી લગતહુકમ ::-

અરજદારની બી.એન.એસ.એસ.કલમ-૪૯૭ અને ૫૦૩ મુજબની અરજી લગત હુકમ અરજદારની હાલની અરજી વંચાણે લીધી.અરજદાર તથા વિધ્વાન એ.પી.પી. શ્રી ને સાંભળ્યા, રજુ દસ્તાવેજો ધ્યાને લીધા. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તેમજ રજુ દસ્તાવેજો ધ્યાને લીધા.

હાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે તેઓ અરજી માં જણાવ્યા મુજબના સરનામે હાલમાં રહે છે તથા તેઓની સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ જે બનાવમાં તેઓના STATE BANK OF INDIA નાં ખાતા નં બર/ક્રેડીટ કાર્ડ નં. 10933991257 માંથી રૂ. 20,000/- ઉપડી ગયેલ હતા. જે બાબત તેઓએ ૧૯૩૦ નંબર ઉપર કોલ કરીને ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદ તારીખ-27/02/2026 ના રોજ Acknowledge No.31102260046829 નંબરથી નોંધાયેલ હતી. જે સબબ સાયબર ક્રાઇમ પોલીસ ધ્વારા સામાવાળા ખાતા ધારક (1) CHANDRAYEE MUKHERJEE ની બેન્ક HDFC Bank ના ખાતા નં.17331530002237 માં ગયેલ નાણાં પૈકી રૂ.19,810/- બી.એન.એસ.એસ.-૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ ફીઝ કરાવેલ હતા જે હાલ સુધી સદર બેન્કમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં જણાવેલ છે કે આ બાબતે એફ.આઈ.આર થયેલ નથી. તેઓને ખુબજ મોટું આર્થિક નુકશાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર રૂપીયાની જરૂર હોય સદર નાણાં તેઓના ખાતામાં પરત અપાવવા માટે બી.એન.એસ.એસ.ની કલમ-૪૯૭ અને ૫૦૩ મુજબ યોગ્ય તે હુકમ થવા અરજ કરેલ છે.

અરજદારની અરજી સબબ તપાસ કરનાર અમલદાર મહુવા ટાઉન પોલીસ સ્ટેશન નાઓને સદર ગુના બાબતે તમામ પેપર સહીત સ્પષ્ટ અભિપ્રાય રજુ કરવા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે એચ.કે.સોલંકી, પોલીસ ઈન્સ્પેક્ટર મહુવા

ટાઉન પોલીસ સ્ટેશન નાઓએ તેઓનો અભિપ્રાય રજુ કરેલ છે. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તથા લગત કાગળો ધ્યાને લેતા તેઓએ જણાવેલ છે કે, સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાણા જ્યારે ઓનલાઇન ટ્રાન્સફર થઈ જતા હોય છે ત્યારે આવા નાણાને તાત્કાલિક રોકવા તથા ગુના અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નં.૧૯૩૦ તથા સાયબર ક્રાઇમ ઈન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ (IRU) સામાન્ય નાગરીકો માટે શરૂ કરવામાં આવેલ છે. જે હાલ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઈડી ક્રાઇમ હસ્તક ચાલુ છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનારનાં નાણા જ્યારે ઓનલાઇન ટ્રાન્સફર થઈ જતા હોય છે તેને તાત્કાલિક રોકવાની કામગીરી કરવામાં આવે છે. સાયબર ક્રાઇમના ભોગ બનનાર નાગરીકો સીધી જ પોતાની ફરીયાદ હેલ્પ લાઇન નં.૧૯૩૦ પર ડાયલ કરીને લખાવે છે ત્યારે Acknowledge Number આપવામાં આવે છે તેમજ સાથોસાથ જે શંકાસ્પદ બેંક ખાતામાં જે તે નાગરીકના નાણા ગયેલ હોય તે બેંકને નાણા ફીઝ કરાવવા તેમજ જો નાણા ત્યાંથી ટ્રાન્સફર થઈ ગયેલ હોય તો તેની માહિતી આપવા માટે તેઓની કચેરીએથી બી.એન.એસ.એસ.-૨૦૨૩ ની કલમ-૯૪ તથા ૧૦૬ હેઠળ નોટીસ આપવામાં આવે છે. નોટીસ આધારે બેંકો દ્વારા આ શંકાસ્પદ રીતે મેળવાયેલા નાણા ફીઝ કરવામાં આવે છે.

વધુમા જણાવેલ છે કે, હાલના અરજદાર જલ્પાબેન રામસિંહ ચૌહાણ રહે. ૫૧, મુનીનગર, મહુવા, જી.ભાવનગર નાઓ સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ હતો. જેમા STATE BANK OF INDIA નાં ખાતા નંબર/ક્રેડિટ કાર્ડ નં. 10933991257 માંથી રૂ. 20,000/- ઉપડી ગયેલ હતા. જે બાબતે અરજદારે ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદ આધારે સાયબર ક્રાઇમ સેલ સીઆઈડી ક્રાઇમ દ્વારા અરજદારના ઉપરોક્ત ખાતામાંથી ગયેલ નાણા પૈકી સામાવાળા ખાતા ધારક (1) CHANDRAYEE MUKHERJEE ની બેંક HDFC Bank ના ખાતા નં.17331530002237 માં ગયેલ નાણાં પૈકી રૂ.19,810/- બી.એન.એસ.એસ.-૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ ફીઝ કરાવેલ છે. જે સદરહું બેંક ખાતા બનાવટી હોવાનું જણાય આવેલ છે અને સદરહું ખાતુ સીઝ

કર્ચા બાદ ખાતેદાર કે અન્ય કોઈ વ્યક્તિએ પોલીસ સમક્ષ કોઈ વાંધા તકરાર જણાવેલ નથી. જેથી સદરહું નાણા પાછા ખેંચવા માટે અરજદારશ્રીએ આપ નામદાર સાહેબની કોર્ટમાં અરજી કરેલ હોય સદરહું નાણા અરજદારને પાછા આપવા અભિપ્રાય આપેલ છે.

સદર કામે અરજી સાથે રજુ કરવામાં આવેલ બેંક પેપર્સની નકલ ધ્યાને લેતા તેમજ તપાસ કરનાર અમલદાર ધ્વારા રજુ કરવામાં આવેલ અભિપ્રાય તથા તેને લગત કાગળો ધ્યાને લેતા તે હકીકત સ્પષ્ટ થાય છે કે હાલના STATE BANK OF INDIA નાં ખાતા નંબર/ક્રેડીટ કાર્ડ નં. 10933991257 માંથી રૂ. 20,000/- ઉપડી ગયેલ હતા તેમજ સદર નાણા સામાવાળા ખાતા ધારક (1) CHANDRAYEE MUKHERJEE ની બેન્ક HDFC Bank ના ખાતા નં.17331530002237 માં ગયેલ નાણાં પૈકી રૂ.19,810/- ફીઝ થયેલ છે અને અરજદારે તે બાબતે ફરીયાદ નોંધાવેલ છે. આમ સદર હકીકત ધ્યાને લેતા અરજદારના ઉપર જણાવ્યા મુજબના ખાતામાંથી નાણા ઉપડી ગયેલ હોવાનું તથા શં કાસ્પદ બેન્કના ખાતામાં ટ્રાન્સફર થયાનું હાલના તબક્કે સ્પષ્ટ જણાઈ આવે છે. તદઉપરાંત રેકર્ડ પરની હકીકત ધ્યાને લેતો હાલના કામે આજદીન સુધી કોઈ એફ.આઈ.આર.થયેલ હોય કે હાલના કામે કોઈની ઘરપકડ કરવામાં આવેલ હોય તેમ જણાઈ આવતું નથી તેમજ બનાવ બન્યે આટલો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં આજદીન સુધી અરજદાર સિવાય અન્ય કોઈએ સદર નાણાની અત્રેની અદાલત સમક્ષ માગણી કરતી કોઈ અરજી કરેલ નથી તદઉપરાંત તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય ધ્યાને લેતા તેઓ સમક્ષ પણ કોઈએ આ નાણાની માગણી કરેલ હોય તેમ જણાતું નથી તેમજ તપાસ કરનાર અમલદાર ધ્વારા સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાવેલ છે તથા સદરહું ખાતું સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતું સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી જેથી તપાસ કરનાર અમલદાર ધ્વારા સદર નાણા અરજદારશ્રીને પાછા આપવા સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. જેથી અત્રેની અદાલતના માનવા મુજબ હાલના અરજદાર સદર નાણાનો કબજો મેળવવા હકકદાર હોવાનું જણાય છે.

આમ ઉપર ચર્ચા કર્યા મુજબ સદર કેસની તમામ હકીકત, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લતા સદર નાણા બેંકમાં જમા હોય તેથી સદર રોકડ રકમના દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમજ ભવિષ્યે પણ મુદ્દામાલની ઓળખ બાબતની કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૩ (૧) જી.એલ.એચ.પાના નંબર ૩૦૭ ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાને લેતા પણ ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

-:: હુકમ ::-

અરજદારની અરજી આથી બી.એન.એસ.એસ.કલમ-૪૯૭ અને ૫૦૩ હેઠળ આથી મંજૂર કરવામાં આવે છે.

અરજદારને સદર ગુનાના કામે સીઝ કરવામાં આવેલ રોકડ રકમ રૂ.19,810/- ની દોઢી રકમના જાત જામીન (બોન્ડ) તથા તેટલી જ રકમના સદ્યર જામીન સંબંધીત પોલીસ સ્ટેશનમાં આપ્યેથી આ કેસના આખરી નિકાલ સુધી નીચેની શરતોને આધીન વચગાળાની કસ્ટડી સ્વરૂપે પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.

વધુમાં હુકમ કરવામાં આવે છે કે અરજદાર દ્વારા હુકમ મુજબના જાત જામીન(બોન્ડ) તથા સદ્યર જામીન પોલીસ સ્ટેશનમાં આપેથી પોલીસ અધિકારી દ્વારા સદર હુકમની જાણ જે તે બેન્કને કરવી તેમજ સામાવાળા ખાતા ધારક સામાવાળા ખાતા ધારક (1) CHANDRAYEE MUKHERJEE ની બેન્ક HDFC Bank ના ખાતા નં.17331530002237 માં ગચેલ નાણાં પૈકી રૂ.19,810/- જમા છે તે રકમ અરજદાર જલ્પાબેન રામસિંહ ચૌહાણ ના **STATE BANK OF INDIA** નાં ખાતા નંબર/ક્રેડીટ કાર્ડ નં.**10933991257** માં જમા કરાવી તેની જાણ અત્રેની અદાલતને તથા લગત પોલીસ સ્ટેશનને કરવી.

શરતો :-

- (૧) અત્રેની અદાલત જ્યારે ફરમાવે ત્યારે અરજદારે આ નાણા જેટલી રકમ અદાલત સમક્ષ રજુ કરવાની રહેશે.
- (૨) ઉપરોક્ત ખાતાધારક વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિ સદર નાણા પર કલેક્ટ કરે અને પોતાનો હક/હિત પુરવાર કરે તેવા સંજોગોમાં અરજદારે સદર રકમ પરત કરવાની રહેશે.
- (૩) સદર મુદ્દામાલ રકમનો કોઈ ગુનાહિત કામે ઉપયોગ કરવો/કરાવવો નહીં.
- (૪) કોઈ પણ શરતનો ભંગ થયેથી હાલનો વચગાળાનો હુકમ આપોઆપ રદ ગણાશે તથા મુદ્દામાલ રોકડ રકમ ફરીથી જપ્ત થવાને પાત્ર રહેશે તથા બોન્ડ અને જામીનગીરીની રકમ પણ વસુલ કરવાને પાત્ર રહેશે.

હુકમ આજરોજ તા. ૧૭^{મી}, માહે જુન, સને. ૨૦૨૬ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો.

તારીખ :- ૧૭ / ૦૬ / ૨૦૨૬ (હિતેશકુમાર બુધાભાઈ શર્મા)
સ્થળ :- મહુવા એડીશનલ ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ,
મહુવા.
કોડ નં. જીજે ૦૧૧૪૭

એચ.એ.છેલાણા